https://archive.org/details/bk1187/page/n0/mode/1up

2010 Around -Nitya Path (1187)

All Items on https://archive.org/details/realpatidar

realpatidar.com

Full Library on https://realpatidar.com/library

ૐ

હરી ઓમ

જન મંગલ નીત્ય પાઠ

પ.પુ. જગદ્‌ગુરૂ શ્રી નાનકદાસજી મહારાજ

કોટી કોટી વંદન

ગુરૂ ગાદી પ્રેરણા પીઠ પીરાણાં

તા. દશકોઈ જી. અમદાવાદ

ફોન : (૦૨૭૧૮) ૨૮૮૨૨૭-૨૮૮૨૨૯

realpatidar.com

https://archive.org/details/bk1187/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

Real Patidar
Unravel Truth

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

https://archive.org/details/bk1187/page/n2/mode/1up

realpatidar.com

ૐ

હરી ઓમ

જન મંગલ નીત્ય પાઠ

પ.પુ. જગદ્‌ગુરૂ શ્રી નાનકદાસજી મહારાજ

કોટી કોટી વંદન

ગુરૂ ગાદી પ્રેરણા પીઠ પીરાણાં

તા. દશકોઈ જી. અમદાવાદ

ફોન : (૦૨૭૧૮) ૨૮૮૨૨૭-૨૮૮૨૨૯

realpatidar.com

https://archive.org/details/bk1187/page/n3/mode/1up

realpatidar.com

પ્રાર્થના

ઓહ ! ઈશ્વર ભજીયે તને, મોટું છે તુજ નામ ।
ગુણ તારા નિત્ય ગાઈએ, થાય અમારાં કામ ॥
હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ ।
ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ ॥
પરોઢિએ નિત ઉઠીને, લેવું ઈશ્વર નામ ।
દાતણ કરી નાહ્યા પછી, કરવા પાઠ તમામ ॥
કહ્યું કરો મા બાપનું, દો મોટાને માન ।
ગુરુને બાપ સમા ગણો, મળશે સારું જ્ઞાન ॥
જૂઠું કદી ન બોલવું, તજવું આળસ અંગ ।
હળમળીને ચાલવું, રાખવો સારો સંગ ॥
ચોખ્ખો મારો ઓટલો, ચોખ્ખો ઘરનો ચોક ।
ચોખ્ખાં કપડા જોઈને, ચોખ્ખું, કહે સૌ લોક ॥
ચોખ્ખું મારું મુખડું, ચોખ્ખા મારા હાથ ।
ચોખ્ખા મારા દિલમાં, રહે જગતનો નાથ ॥

ૐ શાંતિ : ! શાંતિ : ! શાંતિ : !
આટલુ તો અવશ્ય કરો.
હરી ૐ

realpatidar.com

https://archive.org/details/bk1187/page/n4/mode/1up

realpatidar.com

દર્શન લાભ

બ્રહ્મા વિષ્ણુ મહેશ

આદ્ય શક્તિ

ઉમીયા મા ઉંઝા

શ્રી સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ

શ્રી કરશનદાસજી મહારાજ
પ્રેરણા પીઠ

શ્રી જગનનાથજી મહારાજ
ફેજપુર જી. જલગાંવ

શ્રી નાનકદાસજી મહારાજ
પ્રેરણા પીઠ



શ્રી સવગણદાસજી મહારાજ
અથર્વવેદી આશ્રમ કાદીયા
જી. કચ્છ. ભુજ



શ્રી શાંમળદાસજી મહારાજ
કુકસ જી. વડોદરા

realpatidar.com

realpatidar.com

આપણા ભગવા ધારી સંતો

શ્રી સોમદાસ મહારાજ
દીવાળીપુરા
જી. વડોદરા

શ્રી પુરષોત્તમ મહારાજ
અવાખલ
જી. વડોદરા

શ્રી ગંગેશ્વર મહારાજ
મીઠીવાવ
જી. નર્મદા

શ્રી રવિદાસ મહારાજ
પ્રેરણા પીઠ પીરાણાં

શ્રી જનાર્દન મહારાજ
ફૈજપુર જી. જલગાંવ



શ્રી પુર્ણાનંદજી મહારાજ
ફૈજપુર જી. જલગાંવ

શ્રી જયરામદાસ મહારાજ
અથર્વવેદી સતપંથ આશ્રમ
કાદીયા કચ્છ-ભુજ

શ્રી નાથાજી મહારાજ
પટશિષ્ય કુકસ
જી. વડોદરા

શ્રી સુભાષદાસ મહારાજ
રૂણ નડીયાદ જી. ખેડા

ભાભારામ મહારાજ
પટ શિષ્ય દેવા નડીઆદ જી. ખેડા

realpatidar.com

realpatidar.com

નમ્ર નિવેદન

પરમ પૂજય જગત ગુરૂ નાનકદાસ મહારાજના ચરણ કમળમાં પુસ્તીકા મૂકતાં અમો હર્ષ અનુભવીએ છીએ જે કંઈ દોષ રહેવા પામ્યા હોય તો સૂચન કરવા અને ક્ષમા કરવા વિનંતી.

આ જન મંગલ નીત્યપાઠ પુસ્તીકા સતપંથીભાઈઓના ઘરે ઘરે અને આપણાં મુખ્ય દેવ સ્થાનોમાં પ્રસાદ ભાવે આપવાનો પ્રત્ન કરેલ છે.

સતપંથ પ્રકાશન સમિતિ પ્રેરણા પીઠ પીરાંણા પ્રત : ૧૦૦૦૦	જન મંગલ નીત્ય પાઠ પ્રસાદ કીમત ધર્મ લાભ

: સહયોગ આપનાર :

- મા. પુરબાઈ માધવજી વાલજી ગોરાણી અભિષેક - ભુજ
- મા. પુરબાઈ કાનજી વિશ્રામ ભગત રોયલ વિડિયો - ભુજ
- મા. રામબાઈ કરમસી લખુભાઈ ધોળુ મહાલક્ષ્મી ઈન્જી. ક્રુ. ભુજ-ગાંધીનગર
- મા.લીલાવંતીબેન મેઘજી નથુભાઈ વેલાણી બજરંગ બોરવેલ માનકુવા, ભુજ
- મા. કેશરબેન કાનજી નથુભાઈ ધોળુ, રામ બ્લોક, ભુજ

ઓમ શાંતિ શાંતિ શાંતિ - હરી ૐ

શ્રી ઈશ્વરલાલ માધવજી ગોરાણી - મંત્રી

પત્ર વ્યવહાર :સતપંથ સંપ્રદાય મંડળ
ઠે. ૩, પુનમ ચેમ્બર, સ્ટેશન રોડ, ભુજ-કચ્છ.
ફોન : (ઓ) ૨૨૨૩૨૪ (રે.) ૨૨૬૯૪૧ મો.૯૮૨૫૯૦૧૧૨૪

realpatidar.com

realpatidar.com

જયોતિ આકરે તીલક કરવું

ગુરુવંદના (પ્રાર્થના)

(૧) ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા....
ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મયે શ્રી ગુરુદેવ નમ :

(૨) ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મુલમૂ ગુરુ પદમૂ
મંત્ર મૂલમૂ ગુરુવાકય મોક્ષ મૂલમ ગુરુકૃપાય

(૩) યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિભર્વતિ ભારત ।
અભ્યસ્થાનમૂ ધર્મસ્ય તદાત્માનમૂ સૃજામ્યહમૂ ।
પરિત્રાણાય સાધુનામૂ વિનાશાય ચ દુષ્કૃતમૂ ।।
ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે ।

(૪) પદવંદન કરું ગુરૂદેવનું જે સકળ ગુણ ચતુર સુજાણ
પુરણ બ્રહ્મ દ્રષ્ટે કરી અચળ પુરુષ પુરાણ -
પુજન કરું ગુરુ પદનુ જેથી ચૌદે લોક પુજાય
શેષ બ્રહ્મા શકિત મળી, ગુણ ગુરુજીના ગાય
કૃપા હોય જો ગુરુદેવની તો ટળે ચોર્યાશીના તાપ
જન્મ મરણની આપદા છૂટે આપો આપ

●●●

કરદર્શનમ્

હાથના આગળના ભાગમાં લક્ષ્મી, મૂળ ભાગમાં સરસ્વતી અને વચલા ભાગમાં ગોવિંદ વસે છે, માટે સવારે હાથનું દર્શન કરવું.

realpatidar.com

https://archive.org/details/bk1187/page/n8/mode/1up

realpatidar.com

પૃથ્વીને વંદન

સમુદ્રરૂપી કપડાંવાળી, પર્વતરૂપી સ્તનવાળી અને વિષ્ણુ ભગવાનની પત્નીરૂપી હે પૃથ્વી દેવી? તમને નમસ્કાર કરું છું. મારા પગનો સ્પર્શ થાય છે તેને માટે મને ક્ષમા કરો.

●●●

નારાયણને સ્તુતી

નિરાકાર, શૂરવીર, નરોત્તમ, નૃસિંહ ભગવાન, કાલીયનાગને નાથનાર અને નરકનો અંત લાવનાર એવા નારાયણ પ્રભુને હું નમું છું.

●●●

ઊગતા સૂર્ય નારાયણનો મંત્ર

ૐ પરમકૃપાળુ પરમાત્માની કૃપાથી આદરું છું. ૐ નમો શ્રી સદ્‌ગુરૂ પાત્ર બ્રહ્મા ઈન્દ્ર ઈમામશાહ, આદ્ય-વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે......

ઊગતા સુરજ ।। આથમતા ભાણ ।। નર બીજ તે શ્રી નિષ્કલંકી નારાયણ ।। તમે સત્યના પ્રેરક- ધારક રક્ષણહાર ।। પઢંતે ગોર ગાયંત્રી જપે તપે બિંબ ઉપાયા । તબ હે ।। સૂર્ય દેવતા તમારા ચરણે અમે આયા ।। સ્વામી ? તમે નિરંજન નિરાકાર ।। ધર્મ કારણે લીધા અવતાર । એટલી પ્રાર્થના કરે તે નરકે ન જાય ।।

સદ્‌ગુરુ ઈમામશાહ..

ૐ શ્રી નિષ્લંકી નારાયણને નમો નમ :

realpatidar.com

realpatidar.com

ચંદ્ર- દર્શનનો મંત્ર

ૐ પરમકૃપાળુ પરમાત્માની કૃપાથી આદરું છું.
ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા, ઈન્દ્ર ઈમામશાહ આદ્ય-વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે....
દયા, ક્ષમા, શાંતિના વર દાતાર ।। હું છું અરજ કરનાર ઉમેદવાર ।। આજ હો ચંદ્રમા ગુરુ ।। તમે સતિયાનાં સત્ રાખજો ।। અમારા કરગર્યા કાન ધરો ।। સમર્થા સહાય કરો ।. કર્યા અપરાધ ક્ષમા કરો ।। બીજા અપરાધ ના કરાવશો ।। ઝાંખા, મેઘા, કિન્નર તેત્રીસ કરોડીના મેળા આપો ।। અનંત કરોડીની સોબતમાં રાખો ।। લક્ષ ચોર્યાસીના ફેરા ટાળો ।।

સદ્‌ગુરુ ઈમામશાહ....
ૐ શ્રી નિષ્કલંકી નારાયણ ને નમો નમ :

●●●

દીવા જયોત ને પ્રમાણનો મંત્ર

ૐ પરમકૃપાળુ પરમાત્માની કૃપાથી આદરું છું.
ૐ નમો શ્રી સદ્‌ગુરુ પાત્ર બ્રહ્મા ઈન્દ્ર ઈમામશાહ, આદ્ય-વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશીષે....
ગુરુ દીવો ।। ગુરુ દેવતા ।। ગુરુ વિના ઘોર અંધકાર ।। ગુરુ વિના યુકિતનહીં ।। ગુરુ વિના મુકિત નહિ ।. મન તાળું ।। ગુરુ- મંત્ર કૂંચી ખોલો ધર્મ દ્વારા ।। દેખો નારાયણ કા દીદાર ।। તરીએ ભવસાગર પાર

realpatidar.com

realpatidar.com

।। જાગે જયોત ભાગે છોત ।

સદ્દગુરુ ઈમામશાહ....

ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમ :

●●●

ધૂપનો મંત્ર

ૐ પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્દગુરુ પાત્ર બ્રહ્મા, ઈન્દ્ર ઈમામશાહ આદ્ય- વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે....

ધૂપ જલે, અગર જલે, ભવની પીડા ટળે, દેવ જાગે, દૈત્ય ભાગે, ધૂપ ત્યાં રૂપ દેવ ત્યાં પૂજા, અલખ નિરંજન નિરાકાર, અવર દેવ નહી દૂજા..... સદ્દગુરુ ઈમામશાહ... ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ

●●●

સર્વદ્વિ ઋષિવરને નમસ્કારનો મંત્ર

ૐ પરમકૃપાળુ પરમાત્માની કૃપાથી આદરું છું.

ૐ નમો શ્રી સદ્દગુરુ પાત્ર બ્રહ્મા, ઈન્દ્ર ઈમામશાહ આદ્ય- વિષ્ણુ નિરંજન નિષ્કલંકી નારાયણ તમારી આશિષે....

આદ્ય નારાયણને નમસ્કાર ।। બ્રહ્મા, વિષ્ણુ, મહેશને નમસ્કાર આદ્યશકિતને નમસ્કાર ।। શ્રી નિષ્કલંકી નારાયણ ને નમસ્કાર ।। પ્રથમ પુરુષને નમસ્કાર ।। હરિવંશ કુળ કાયમના પરિવારને નમસ્કાર ।। ધરતી આસમાનને નમસ્કાર ।। પવન-પાણીને નમસ્કાર ।। ચંદ્ર- સૂર્યને

realpatidar.com

https://archive.org/details/bk1187/page/n11/mode/1up

realpatidar.com

નમસ્કાર ।। નવ લાખ તારાને નમસ્કાર ।। બાર મેઘ ને નમસ્કાર ।। નવકુળ નાગને નમસ્કાર ।। સાત સમુદ્રને નમસ્કાર ।।
નવસો નવાણુ નદીઓને નમસ્કાર ।। અગિયાર રૂદ્રને નમસ્કાર ।। બાર આદિત્યને નમસ્કાર ।। આઠ વસુને નમસ્કાર ।। અશ્વિની કુમારને નમસ્કાર ।। ઓગણપચાસ મરૂતને નમસ્કાર ।। ચૌદ બ્રહ્માંડને નમસ્કાર ।। નવગ્રહને નમસ્કાર ।। સાત વાર, સત્તાવીસ નક્ષત્રને નમસ્કાર ।। પંદર તિથિ બારકરણને નમસ્કાર ।।
।। સાત દ્વિપને નમસ્કાર નવખંડ પૃથ્વીને નમસ્કાર ।।
ચોવીસ મુલકને નમસ્કાર ।। અષ્ટકુળ પર્વતને નમસ્કાર ।। અઢાર ભાર વનસ્પતિને નમસ્કાર ।। ચાર વેદને નમસ્કાર ।। ચાર ગ્રંથને નમસ્કાર, ચાર ખાણ, ચાર વાણને નમસ્કાર અગ્નિ, તેજ અન્નદેવને નમસ્કાર ।। આદિ, અંત, મધ્યના દેવને નમસ્કાર ।। ઉત્તર, દક્ષિણ, પૂર્વ પશ્ચિમને નમસ્કાર ।। દશ દિગ્પાળને નમસ્કાર ।। દશે દીશાઓને નમસ્કાર ।। નવનાથ ચોર્યાસી સિધ્ધને નમસ્કાર ।। ચોસઠ જોગણીને નમસ્કાર ।। અઠયાસી સહસ્ત્ર ઋષિને નમસ્કાર ।। એક લાખ એંશી હજાર સંત-મહાત્માઓને નમસ્કાર, અડસઠ તીર્થને નમસ્કાર ।। નવાણુ કરોડ ઝાંખાને નમસ્કાર ।। છપ્પનકરોડી મેંઘાને નમસ્કાર ।। બત્રીસ કરોડી કિન્નરને નમસ્કાર ।। પાંચ કરોડી પ્રહલાદને નમસ્કાર ।। સાત કરોડી હરિશ્ચંદ્રને નમસ્કાર ।। નવ કરોડી યુધિષ્ઠીરને નમસ્કાર ।। બાર કરોડી કમળા કુવરને નમસ્કાર ।। ત્રેતીસ કરોડી

realpatidar.com

https://archive.org/details/bk1187/page/n12/mode/1up

realpatidar.com

દેવતાને નમસ્કાર ॥ સર્વ ઋષિવર ગત-ગંગાને નમસ્કાર, ॥ દશે અવતારને નમસ્કાર, મુખી સેવકને નમસ્કાર, ચૌદ-ભુવનના દેવ-ઋષિવરને નમસ્કાર ॥ કરણ કલ્પના અનંત કરોડી દેવને નમસ્કાર ॥ સ્વામી? અમારા અપરાધ ક્ષમા કરો, સતપંથના માર્ગ માંહે રાખો ॥ લક્ષ ચોર્યાસીના ફેરા ટાળો ।. તેત્રીસ કરોડીના મેળા આપો ॥ જાંબુ દ્વિપના ધણી ॥

સદ્‌ગુરુ ઈમામશાહ...

ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ

●●●

સદ્‌ગુરૂની શિખામણ

સદ્‌ગોર તણી શિખામણ સાચી, સાંભળો ઋષિવર એકાંતિ.. ૧
દિન પર્તે કરો ધામ સુ ધંધા,સાંજ પડે થાઓ સાહેબ કા બંદા..૨
કોઈ કેની ન કરશો નિંદા, જઈ ગોર ગતમાં ને કહો હેજંદા..૩
ગોર મુખે તમે રહો રે બંદા, ઋષિવર કેરી યેહી સંધ્યા..૪
એમ વંદો સંધ્યા ઋષિવર ભાઈ, મેલો ક્રોધ, ન કરશો ઈર્ષાઈ..૫
મન મારો તો મમતા મૂઈ, ધર્મશાળામાં ન રહેશો સૂઈ..૬
ધર્મશાળામાં પર વાત ન કરશો, આહાર ઘણું કરી પેટ ન ભરશો..૭
ભરશો પેટ તો ભારી થાશો, આવશે નિંદ્રા પછી પસ્તાશો..૮
હળવે પેટે હાંસલ થાશે, જાગતાં જીતશો સદ્‌ગોર સાથે..૯
વડા મોટાની અદબે રહેજો, મોટા તણા બે અવગુણ સહેજો..૧૦

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1187/page/n13/mode/1up

realpatidar.com

દહાડો વડો તેને વરસ કરી જાણો,બોલો મીઠા વચને પ્રેમ જ આણો..૧૧
આપણાથી જે નાનેરો ભાઈ, તેને બોલવો મોટેરો. કહી..૧૨
મીઠા વચને બોલો વીરા તમ મુખે તો ઝળકે હીરા..૧૩
સદ્‌ગોર મલ્યાનો એ છે ભેદ,ઋષિવર ઋષિવરનો ન કરશો ખેદ ૧૪
સાંભળે રૂડું ને આચરે કૂડું,નીશ્ચે તેનું થાશે જ ભૂંડું..૧૫
આળસ નિંદ્રા ન કરવી જાણી,જૂઠ તજો વેદ વચન પ્રમાણી..૧૬
કૂડ કપટ સર્વે નાખો કાઢી,અમીરસ પી, નીશાની લો દહાડી..૧૭
ઘર થકી ધર્મશાળામાં આવો.ઉપજાવી ભાવ નીશાની લાવો,૧૮
સંપત્ત ઊપજે તે તમે લાવો,મુખી સાથે નવ કરશો દાવો..૧૯
દાવો કરે દુનિયાને ભાવે,આવે દારિદ્ર ને દેવ નહીં પાવે..૨૦
અધર્મીને ઉણયાચારી,જાણ્યું અજાણ્યું તે દે પચારી..૨૧
સુતક લાઈ ભર્યા જો રહેશો,હાણ ઊપજશે બહુ દુઃખ સહેશો..૨૧
અમી નિશાની નહીં લો દાડી,તો ગોરજી મેલશે ગતમાંથી કાઢી..૨૩
ધર્મી ધીગાણાની વાત ન જાણે, અધર્મી મનમાં ઓછું આણે..૨૪
જ્ઞાન ધ્યાનમાં જુઓ વિચારી,હાણ વર્ધને જુઓ તપાસી..૨૫
ધ્યાન ધરી તમે જાળો સ્મરણી,છાના છુપા કરો ઉત્તમ કરણી..૨૬
એવા ગુણ ગંભીરે ભરીયા,ઋષિવર પાળો સોએ ક્રિયા..૨૭
પ્રથમ હ્રદય ધોઈ નિર્મળ કરવું.બીજી ક્રિયા નીત ન્હાઈને જમવું..૨૮
સત્યે ચાલવું રાત ને દીવસ,તેમાં સાચુ બોલવું નિશ્ચે..૨૯
દયા રાખવી દિલમાં જાણી, સુપાત્રને દાન દેવું પ્રાણી..૩૦

realpatidar.com

https://archive.org/details/bk1187/page/n14/mode/1up

realpatidar.com

પર દુઃખ જાણી પાસે રહેવું ભાઈ, મોટાને તો માનવા સહી..૩૧
મોટાઈનો મન ગર્વ ન કરવો, દસમી ક્રિયા જે ક્રોધ ન કરવો..૩૨
ધર્મ તણું આળસ ન કરવું. સરજથા સાથે ધ્યાન જ ધરવું..૩૩
નિત-નિત ગતમાં મલવું જાઈ,ગોરનર મુખીને મળવું ધાઈ..૩૪
નિત-નિત અમી પીએ તે ધર્મી,અહંકાર મૂકે તે નર કર્મી..૩૫
જૂઠું ઋષિવરને બોલવું નહીં,અતિથિ અભ્યાગત સંતોષવા સહી..૩૬
ભૂખ્યાંને અન્ન આપવું જાણી,તરસ્યાને તો પાવું પાણી..૩૭
નાગાને વસ્ત્ર આપી અર્થ જ લેવો,સગાકુંટુબ નો ભાર જ સહેવો..૩૮
સઘળું સાંખી કરી, ધ્યાન જ ધરવું.અવગુણ કરે તેનો ગુણ જ કરવો..૩૯
ઓછું કોઈને આપવું નહીંઅદકુ કોઈનું લેવું નહીં,૪૦
પરસ્ત્રી ગમન તો કરવું નહીં,ભૂંડી નજરે ન જોવું ભાઈ..૪૧
જાણી-અજાણી ન દીજે ગવાહી,કૂડ-કપટે ન ચાલશો ભાઈ..૪૨
મુખથી મર ન કહેવું લગાર,વ્યાજ ખાય તેનો ન લેવો આહાર..૪૩
હાડ વકરો કરે પાતક સહી,પશુ પાળી ને વેચું નહીં..૪૪
ધરતીનું મૂલ ન કરશો માતા,કન્યા તણું રખે દ્રવ્ય જ ખાતા..૪૫
લાંચ ન ખાવી એક રતી,ખોટું ખત નવ લખશો સતી..૪૬
મેદાને જઈ પાંચ આચમન કીજે.ચાલીશ ક્રિયા ઋષિવર પાળી લીજે..૪૭
માટી લઈને ધોવા હાથ, ન્હાઈ કરીને થાવું પાક૪૮
પાણી લઈને પેશા જ કરવી,આચમન ત્રણ કરે તે નર ધર્મી..૪૯
અણગળ્યું નીર ન પીવું પ્રાણી,જીવતો જીવ ન મારવો જાણી..૫૦

realpatidar.com

https://archive.org/details/bk1187/page/n15/mode/1up

realpatidar.com

હીંગ તમાકુ ન ખાશો કોઇ.અમલ આહાર તજો નર જોઈ..૫૧
દનીમાં બેસીને ખાવું નહીં,એઠું જુઠું ન ખાશો ભાઈ..૫૨
ગળીનાં વસ્ત્ર પહેરવાં નહીં,નીચની સંગત ન કરવી સહી..૫૩
અપાવસ વ્રતની આશ ન ધરવી,પ્રાણી પથ્થરની પૂજા ન કરવી..૫૪
મેલી થાપણ ન રાખવી જાણી,વખત વેળા ન ચૂકશો પ્રાણી..૫૫
અમ્મર થઈએ તે જપીએ જાપ,વણ પૂછે ખાધે છે પાપ..૫૬
પા-ઘડી જતી ન કરશો લગારી,ચાંપી-આહર ન લેશો લગાર..૫૭
લાલચે-પ્રીત ન કરવી ભાઈ,માતા કહી જાણો મોટી ભોજાઈ..૫૮
અરૂપરૂ નવ કરશો ઋષિ,પાડોશી દુભવી નવ કરશો દુઃખી..૫૯
વિશ્વાસઘાત ન કરવો સહી,પડી જડી વસ્તુ ન લેવી..૬૦
કોઈને આળ ન ચડાવવી જાણી,ઉછીનું ન રાખવું પ્રાણી..૬૧
પારકું ધન લઈ ભાગવું નહીં.પુત્ર થઈને આપવું સહી..૬૨
કોઈને ગાળ ન દેવી જાણી,મુર્ખપણામાં ન રહેવું પ્રાણી..૬૩
જ્ઞાન દ્રષ્ટે જોવું સૌને સરખું,શત્રુ કરે તે નવ જ કરવું..૬૪
સાચો જૂઠો ન કરવો વાદ,જૂઆ જુગટા નો ન કરવો સ્વાદ..૬૫
નાચ-છંદ ભવૈયા જોવા નહીં,એ છલભેદે સદ્દગોર ખોવા સહી..૬૬
જમતાં ખાટું ન કહેવું ભાઈ,વખાણવું પણ વખોડવું નહીં..૬૭
પ્રભાતે ન્હાઈને બહાર નીસરવું,સંસાર કરે તે નવ જ કરવું,.૬૮
તપતીર્થને કરવું સ્નાન,નિર્મળ થઈને ધરવું ધ્યાન..૬૯
આપણા પ્રાણીને દુઃખ નવ દીજે,દર દીવાને પ્રિત નવ કીજે..૭૦

realpatidar.com

https://archive.org/details/bk1187/page/n16/mode/1up

realpatidar.com

હાલતાં-ચાલતાં ખાવું ન ખાશો,કુદર્શન કરી પસ્તાવશો..૭૧
વેદ શાસ્ત્ર કહે તેમ કરવું સહી,ચતુરાઇ ચોખ્ખાઇમાં રહેવું ભાઇ..૭૨
ઝેર ખાઇ જંપ્લાઇ ન મરવું,આવાગમનમાં ફરી અવતરવું..૭૩
જોર જુવાની વશ જે કરવી,પરસ્ત્રી સાથે સંગ ન કરવી,.૭૪
આગને એઠું પાણી ન છાંટવું જાણી,લીલું ઝાડ ન ભાંગવું પ્રાણી..૭૫
પ્રભાતે ફૂલ ચૂંટવાના છે બહુ દોષ,પ્રાણી પથ્થર પૂજે નહીં પામો મોક્ષ..૭૬
અવાચક પ્રાણીની આલ ન કરવી,ભોજન છાંડી બેસ ઊટ ન કરવી,.૭૭
એઠું પશુને ન આપવું પ્રાણી,એબ કોઈની ન ઉગાડવી જાણી..૭૮
ભાંજગડ કોઈની કરવી નહીં,ગોરનાં વચન ન લોપવાં સહી..૭૯
શિખામણ પૂછે તેને સાચી દીદે,લઈ માળા હરિનું સ્મરણ કીજે..૮૦
પીઓ અમીરસ બ્રહ્માજી મલિયા,ઋષિવર પાળો સૌએ ક્રિયા..૮૧
નવા ધર્મીને ધર્મ અપાવો જોઈ,સો ક્રિયાની પહેરાવો જનોઈ..૮૨
થયા બ્રાહ્મણ બ્રહ્માજી મલીયા,અવાગમનના ફેરા ટળીયા..૮૩
ઋષિવર સાંભલો બ્રહ્મજ્ઞાન,ગતમાં જઈ કરો ગંગાસ્નાન..૮૪
બ્રહ્મજ્ઞાન ગોર નરને ભાવે,અણસઠ તીરથ ગુરુ ચરણે આવે..૮૫
પ્રત્યક્ષ ગોરનર ગતમાં બેઠા,ભાગ્ય જેના સદ્દગોર જ્ઞાને દીઠા..૮૬
જ્ઞાન ધ્યાનમાં જુઓ વિચારી,દુનિયા માંહે દેવ ગુપત અવતારી..૮૭
ઋષિવર તેજે રાખે જ્ઞાન,નિર્મળ થઈને ધરવું ધ્યાન.૮૮
મુનિવર તેજે વારે મન, કરે કસોટી કાયા રતન.૮૯
ભણે ઈમામશાહ સુણો ગત સોહી,ગતમાં બેસીને ઈમાન રાખો સબ કોઈ.૯૦

realpatidar.com

email: mail@realpatidar.com

https://archive.org/details/bk1187/page/n17/mode/1up

realpatidar.com

જે સદ્ગોર આદ્ય તપસ્વી ક્હેલાએ, સો તપસ્વી જાંબુદ્વિપમાં આયે..૯૧
ગોરનર જાંબુદ્વિપે આવ્યા સહી,મુનિવર આરાધો એક મના થઈ..૯૨
ગોર નરે જાંબુદ્વિપે પૂર્યો વાસ,તમે રાખો અમરાપુરની આશ..૯૩
વાચા પાળો ઓચરો બ્રહ્મજ્ઞાન,રહો ઋષિવર એકે ધ્યાન..૯૪
જે રૂપે ગોર નર હોય સહી,તે રૂપે જાપ જપવો મુનિવર ભાઈ.. ૯૫
નીચા નમી-નમી કરો પ્રણામ,ગોર નરે જાંબુદ્વિપે કર્યો મુકામ..૯૬
જે પુરા પ્રેમસું ધર્મે ધાઓ,તો ઋષિવર અમરાપુરમાં જાઓ..૯૭
અમ્મરભેદે અમરાપુરી લેશો,ઋષિવર અમ્મરગઢમાં રહેશો..૯૮
અમ્મર ફળનાં ભોજન કરશો,અનંત કલફની આવરદા ભોગવશો..૯૯
ઋષિવર એકમને ગોરની વાચા પાળો,બોલ્યા ઈમામશાહ અમરાપુર માલો.૧૦૦

●●●

આરતી

ૐ જય જગદીશ હરે... પ્રભુ જય જગદીશ હરે...
ભકતજનો કે સંકેટ...(૨) ક્ષણમેં દૂર કરે...
ૐ જય જગદીશ હરે...
જો ધ્યાવે ફલ પાવે દુ:ખ બિનસે મનકા...
સુખ સંપત્તિ ઘર આવે... કષ્ટ મીટે તનકા...ૐ જય...
માતા-પિતા તુમ મેરે શરણ ગ્રહું મેં કિસકી...
તુમ બીન ઔર ન દુજા (૨) આશા કરૂં મૈં કીસકી...ૐ જય...
તુમ પુરણ પરમાત્માં તુમ અંતરયામી

realpatidar.com

https://archive.org/details/bk1187/page/n18/mode/1up

realpatidar.com

પરિ-બ્રહ્મા પરમેશ્વર તુમ સબકે સ્વામી

તુમ કરૂણા કે સાગર.... તુમ પાલન કર્તા...ૐ જય...

મૈં મુરખ ખલ કામી (૨) કૃપા કરો ભર્તા...ૐ જય...

તુમ હો એક અગોચર સબકે પ્રાણપતિ,

કીસ વિધ મિલુ દયામય (૨) તુમકો મૈં કુમિત...ૐ જય...

દીન બંધુ દુઃખ હર્તા તુમ પ્રભુ મેરે...

અપને હાથ બઢાઓ (૨) દ્વારા ખડા તેરે...ૐ જય...

વિષય વિકાર મીટાઓ પાપ હરો દેવા.

શ્રધ્ધાભક્તિ બઢાઓ (૨) સંતન કી સેવા....ૐજય.....

ૐ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય.

ૐ શ્રી સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ કી જય.

ૐ શ્રી સતપંથ સનાતન ધર્મ કી જય.

ૐ શ્રી કરસનદાસજી મહારાજ કી જય.

ૐ અપના અપના ગુરુ મહારાજ કી જય.

ૐ શ્રી જગદ્‌ગુરુ નાનકદાસ મહારાજ કી જય.

●●●

દશ અવતારની આરતી...

જયદેવ જયદેવ? જય સદ્‌ગુરુસ્વામી ? પ્રભુ, જય સદ્‌ગુરુસ્વામી

આરતી કીજે નકલંક દેવની અક્ષય પદ ધામી ।। જયદેવ

પ્રથમ મચ્છ અવતારે માર્યો શંખાસુર પાપી ।। પ્રભુ માર્યો

realpatidar.com

realpatidar.com

ચાર વેદ લાવીને દીધા, બ્રહ્માને આપ્યા ।। જયદેવ ૧
બીજે કુર્મ અવતારે, પર્વત પીઠ ઉપર ધાર્યો ।। પ્રભુ પર્વત
સાત સમુદ્ર મંથન કરીને, ચૌદ રતન કાઢયાં ।। જયદેવ ૨
ત્રીજે વરાહ અવતારે, માર્યો મોરધ્વજ પાપી ।। પ્રભુ માર્યો
દાઢે ગ્રહી લઈ આવ્યા, અવની ઉર સ્થાપી ।। જયદેવ ૩
ચોથો નરસિંહ અવતારે, માર્યો હિરણ્યાકશ્યપ ભૂપ પ્રભુ માર્યો
નખથી માર્યો પાપી, લઈ નરસિંહ રૂપ ।। જયદેવ ૪
પાંચમે મહા બલિરાય, દેખી સુરનર કાંપ્યા? પ્રભુ દેખી
વામન રૂપ ધરી બલીને, પાતાળે ચાંપ્યા ।। જયદેવ ૫
છઠે પરશુરામ અવતારે, ફરશી હાથોમાં લીધી પ્રભુ ફરશી
સહસ્ત્રાર્જુન મારી પૃથ્વી નક્ષત્રી કીધી ।। જયદેવ ૬
સાતમે રામ અવતારે, આનંદ કૌશલ્યા પામી ? પ્રભુ આનંદ
દશમુખ રાવણ માર્યો, સીતાના સ્વામી ।। જયદેવ ૭
આઠમે કૃષ્ણ અવતારે, ગોવિંદ ગોળકુ ગૌ ચારી પ્રભુ ગો.
મામા કંસને માર્યો, ગોવર્ધન ધારી ।। જયદેવ ૮
નવમે બુધ્ધ અવતારે, ભાર ભૂમિ પર વધ્યો ? પ્રભુ ભાર
ધ્યાન ધરી ધરણીધર બેઠા, યોગ યુગાત સાધ્યો ।। જયદેવ ૯
દશમે નકલંકી અવતાર, પૃથ્વી નકલંકી કરશે ? પ્રભુ પથ્વી
દૈત્યને મારીને હરિ સુધ સેવકની લેશે ।। જયદેવ ૧૦
દશ અવતારની આરતી, જે કોઈ ભાવે ગાશે ? પ્રભુ જે કોઈ

realpatidar.com

https://archive.org/details/bk1187/page/n20/mode/1up

realpatidar.com

આરતી બોલ્યા સદ્‌ગુરૂ બ્રહ્મા, મોક્ષગતિ થશે ।। જયદેવ ૧૧

ૐ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય.

ૐ શ્રી સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજ કી જય.

ૐ શ્રી સતપંથ સનાતન ધર્મ કી જય.

ૐ શ્રી કરસનદાસજી મહારાજ કી જય.

ૐ અપને અપને ગુરુ મહારાજ કી જય.

ૐ શ્રી જગદ્‌ગુરુ નાનકદાસ મહારાજ કી જય.

●●●

મંત્ર: દશતરી હરીઅંશ ગાયત્રી (મોટી)

પ્રથમ પરમેશ્વરા, પવાદે જળ સાગરા, સેવાને કારણેહેત રચંતે, ધરતી ઉપર પાએ ન દેતવા, સદા સર્વે પ્રલયે ગતમ્, પ્રથમ નિલ વર્ણે તે ધંધુકાર, ત્યારે સ્વામી આદ્ય નિરંજન નિરાકાર ત્યાં કવન ચેન પરિવર્તતિ દબૂ દેહિત આદ્ય પુરુષ નારાયણ, આપમને આપ ધ્યાન કર્તવ્યમ્ હો સ્વામીજી ?

તદા નૂર નિર્વાણ આપ હસતકે, તદા નિરંજન તે નિરાકાર, તહાં નિલવર્ણે તે ધંધુકાર, ત્યારે નહિ સાદ, નહિ શબ્દ, નહિઉનાદ, નહિ ઓમકાર (ૐ) નહિ ઉત્પન્ન, નહિ રેવત, નહિરચના, નહિ પવન, નહિ પાણી, નહિ ખાણી, નહિ વાણી, નહિ વેદ,નહિ ભેદ, નહિ જળ, નહિ કમળ, નહિ હમળ, નહિ વમળ, નહિપર્વત, નહિ પાષાણ, નહિ નદિયો, નહિ નવાણ,

realpatidar.com

realpatidar.com

નહિ સમુદ્ર, નહિ સાગર, નહિ ગિરીવર, નહિ કૈલાસ, નહિ મેરુ, નહિ મેખલા, નહિ સ્વર્ગ, નહિ નર્ક, નહિ મૃત્યુ, નહિ પાતાળ, નહિ ધરતી, નહિ આકાશ, નહિ ચંદ્ર, નહિ સૂર્ય, નહિ તારા, નહિ ધ્રુ, નહિ મેઘ, નહિ મંડળ, નહિ રેણી, નહિ દિવસ, નહિ સુન, નહિ પોકાર, નહિ જરણ, નહિ મરણ, નહિ સૃષ્ટિ, નહિ સંયોગ, નહિ ભાવ, નહિ ભયંકાર,નહિ રૂપ નહિ રેખા, નહિ રાગ, નહિ ભાષા, નહિ દમ નહિ કદમ, નહિ ધર્મ, નહિ ધર્મકાર, નહિ રીત, નહિ કરીત, નહિ યોગ, નહિ યુકિત, નહિ શકત, નહિ ભકત, નહિ મોહ, નહિ માયા, નહિ કામ, નહિ કાયા, ત્યારે ભાવ ભેદ કાંઈ નહોતા, તદા આદ્ય નિરંજનને કઈ પેરે સૃષ્ટિ નિપાઈ । હો સ્વામીજી !

પ્રથમ નિલવર્ણ ધંધુકાર મધ્યે ૐ (ઓમકાર), ૐ (ઓમકાર) થી હેત ધરિયા, હેતથી નીર ઝરીયા, નીરથી ખીર કરીયા, ખીરથી ફીણ ઉપાયા, ફીણ માંહેથી ઈંડ નીપાયા, ઈંડ થકી રચંતે સર્વ રચના, ઈંડા છેદીને ત્રણ ભુવન સૂજયા હો સ્વામીજી !

પ્રથમ જમીનની જડ બાંધતાં, યુગ પાંચ (૫), પાંચ યુગ તો પિયાલ થોભંતા, ૫, પાંચ યુગતો ગઢ મેરૂ ઊઠંતાં, ૫, પાંચ યુગ તો બ્રહ્માંડ જડંતા, ૮, આઠ યુગ તો ગીતા ગાયત્રી આચરંતા, ૯, નવ યુગ તો નીર નવાણં ભરંતાં, ૧૨, બાર યુગ તો રૂંઢમાળા

realpatidar.com

realpatidar.com

ફેરવતાં, ૨૦, વીસ યુગ તો વિભુ વનસ્પતિ વસંતાં, ૩, ત્રણ યુગતો ત્રિભુવન ત્રિશૂળ ધરંતા, ૧, એક યુગ તો ૐ (ઓમકાર) બોલી ભણંતાં, એવા તોતેર યુગ તો વહી ગયા સ્વામીજીને અટકળ કરંતાં,

તદા અગમ અગોચર સદગોર બ્રહ્મા, નર નારાયણ, દેવ માહેશ્વર, એ ત્રણ દેવની જે કોઇ પૂજા કરે તેના આવાગમનના ફેરા ટળે.

તદા સ્વામીજીએ પહેલા રોપ્યા સત્ય, સત્ય ઉપર દત્ત, દત્ત ઉપર ક્ષમા, ક્ષમા ઉપર ગજા, ગજા ઉપર નીલ, નીલ ઉપર શેષનાગ, શેષનાગની ફેણ ઉપર ધબળા ધોરી, ધબળા ધોરીના શીંગ ઉપર એક રાઈ, એટલા ઉપર યત્ન કરી સ્વામી એ સૃષ્ટિ નિપાઇ.

જે કરણ કલફના અવતાર પાત્ર સુણો ઋષિવર ભાઈ ? જયાં થકી સ્વામીજીએ રૂપ ધર્યાં, તે રૂપને ઓળખીને આજ કરો કમાઈ.

પ્રથમ નામતો નીલ ૧, અનીલ ૨, સુન ૩, સાન્ ૪, ધ્યાન ૫, જ્ઞાન ૬, મયાન ૭, નૂર ૮, તેજ ૯, જળ ૧૦, કમળ ૧૧, કદમ ૧૨, આધબુધ્ધ ૧૩, નાદ બુધ્ધ ૧૪, ગજતત્તવ ૧૫, પ્રેમ તત્તવ ૧૬, આધ પુરુષ ૧૭, આધ પુરુષથી ૐ (ઓમકાર), ૐ (ઓમકાર)થી ચારે વેદ પ્રકાર, આધ પુરુષથી નાભિચક ।। નાભિ ચકથી ભયે ગોર બ્રહ્મા, સર્વ સૃષ્ટિની ઉત્પત્તિ જે ચાર

realpatidar.com

realpatidar.com

કલફના આવતાર પાત્ર સાંભળો મુનિવર ભાઈ ? જ્યાં થકી ગોર નરે અવતાર લીધા તે અવતારને ઓળખીને આજ કરો કમાઈ.

પ્રથમ નામ તો ૐ (ઓમ) (૧) ઉનાદ (૨) અવીગત્ય (૩) અહેદ (૪) હવ (૫) કવ (૬) તત્વ (૭) ધર્મ (૮) તેજ (૯) કેવળીક (૧૦) નાદ (૧૧) ઓત્રા (૧૨) હરિતખ્ત (૧૩) પુરવા (૧૪) અતિત્ વંશી (૧૫) પ્રેમ ઋષિ (૧૬) વંશ તો શ્રી મત્સ્ય ભગવાન (૧૭).

શ્રી મત્સ્ય ભગવાનની માતા તો શંખાવતી, પિતા તો પરમઋષિ, શક્તિ તો દેવી ચંદ્રિકા, ગોર તો માનધાતા, સ્થાન તો હંસપુર, ક્ષેત્ર તો દ્વારામતી, ત્યાં નર દલો દાનવ તો શંખાસુર, વિચાર તો ઋગ્વેદ, ઓચરંતે ગાયંત્રી, સાત વાર સતાવીસ નક્ષત્ર, પંદર તિથિ બાર કરણ, નવગ્રહ, સૂર્ય મંત્રનો જાપ જપતા આવ્યા, સ્વામી ? ઋષિઓને સ્થાપી, શંખાસુરને સંહારી, સાતે પાતાળના રાજાઓને વચન આપી, સદ્‌ગોર બ્રહ્માનાં વેદ વાળી, સવાક્રોડી સહ રૂખમાંગત્ ભકતને ઓધારી, તમે ભલે અવતર્યા યુગે યુગે દેવ મુરારી. જે કોઈ ચિત્ત હરિ શું લાએ, તેનાં ધર્મ વધે ને પાપનો ક્ષય થાય, નામો નામો ભાઈ પરિબ્રહ્મ નારાયણના નામને, જે રૂપે આપણા સદ્‌ગોર બ્રહ્મા, નર નારાયણ હોય ? આજ તે રૂપને ધાઈએ.

અવતાર પહેલો શ્રી મત્સ્ય ચાર લાખ બત્રીસ

realpatidar.com

realpatidar.com

હજાર(૪,૩૨,૦૦૦) વર્ષ વર્તતે.

સંપૂર્ણ

શ્રી મત્સ્ય મનાઈત ૧૮, ઉગ્રસેન ૧૯, અજુવંત ૨૦, બ્રહસ્પત ૨૧, અશોમિત્ર ૨૨, પ્રીકમ ઋષિ ૨૩, વંશ તો શ્રી કૂર્મ ભગવાન ૨૪.

શ્રી કૂર્મ ભગવાનની માતા તો કમળાવતી, પિતા તો પ્રીતમ ઋષિ, શકિત તો દેવી બેચરા, ગોર તો એકાઅંકી, સ્થાન તો મહાપુર, ક્ષેત્ર તો માનસરોવર, ત્યાં નદ દલો દાનવ તો મધુકેટ્‌ક, વિચાર તો ઋગ્વેદ, ઓચરંતે ગાયત્રી, સાતવાર સત્તાવીસ નક્ષત્ર, પંદર તિથિને બાર કરણ, નવ ગ્રહ સૂર્ય મંત્રનો જાપ જપતા, આવ્યા સ્વામી ? ઋષિયોને સ્થાપી, મધુકટ્‌ક દાનવને સંહારી, ચૌદ રત્નને વાળી, સવા ક્રોડીસહ રાજા અમરિષને ઓધારી, તમે ભલે અવતર્યા યુગે યુગે દેવ મુરારી. જે કોઈ ચિત્ત હરિશું લાએ, તેનાં ધર્મ વધે ને પાપનો ક્ષય થાય. નમો નમો ભાઈ પરિબ્રહ્મ નારાયણના નામ ને, જેણે રૂપે આપણા સ્વામીજી સદગોર, બ્રહ્મા, નર નારાયણ હોય આજ તે રૂપને ધાઈએ.

અવતાર બીજો શ્રી કૂર્મ, ચાર લાખ ને બત્રીસ હજાર (૪,૩૨,૦૦૦) વર્ષ વર્તતે.

સંપૂર્ણ

શ્રી કૂમના વસરત (૨૫) દકાઈત (૨૬) કાત્યાયન

realpatidar.com

realpatidar.com

(૨૭) પરજાઈત્ (૨૮) દાઢમ ઋષિ (૨૯) વંશ તો શ્રીવરાહ ભગવાન (૩૦).

શ્રી વરાહ ભગવાનની માતા તો પદ્માવતી, પિતા તો દાઢમ ઋષિ, શકિત તો દેવી સોમૈયા, ગોર તો અંકેશ્વર, સ્થાન તો માયાપુર (મહિકાપુર) ક્ષેત્ર તો ભૈકાસુર. ત્યાં નર દલો દાનવ. મયુરધ્વજ વિચાર તો ઋગ્વેદ, ઓચરંતે ગાયત્રી, સાત વાર સતાવીશ નક્ષત્ર, પંદર તિથિ ને બાર કરણ, નવ ગ્રહ, સૂર્યમંત્રનો જાપ જપતા આવ્યા. સ્વામી ? ઋષિઓને સ્થાપી મયુરધ્વજ દહીંત ને સંહારી, સવા ક્રોડીસહ રાજા ધ્રુવભકતને ઓધારી, તમે ભલે અવતર્યા યુગે યુગે દેવ મુરારી. જે કોઈ ચિત હરિશું લાયે, તેનાં ધર્મ વધેય ને પાપનો ક્ષય થાય. નમો નમો ભાઈ પરિબ્રહ્મ નારાયણના નામને, જેણે રૂપે આપણા સદ્ગોર સ્વામી નર નારાયણ હોય ? આજ તે રૂપને ધાઈએ.

અવતાર ત્રીજો શ્રી વરાહ ચાર લાખ બત્રીસ હજાર (૪,૩૨,૦૦૦) વર્ષે વર્તિ.

સંપૂર્ણ

શ્રીવરાહના દેહેર ૩૧ રૂપક, ૩૨ કેશવ, ૩૩ નશખલિપત્ય ૩૪ ગૌતમ, ૩૫ અમરિષ, ૩૬ વંશ તો શ્રીનૃસિંહ ભગવાન ૩૭.

શ્રીનૃસિંહ ભગવાનની માતા તો ચંદ્રાવલી, પિતા તો અમરિષ શકિત તો તુલજા ભવાની, ગોર તો અમ્મરતેજ, સ્થાન

realpatidar.com

https://archive.org/details/bk1187/page/n26/mode/1up

realpatidar.com

તો કાશ્મિર, ક્ષેત્ર તો ચરમાપુરી. ત્યાં નર દલો દાનવ તો હિર્ણાક્ષિપુ. વિચાર તો ઋગ્વેદ, ઓચરંતે ગાયત્રી, સાત વાર સતાવશી નક્ષત્ર પંદર તિથિ ને બાર કરણ, નવ ગ્રહ, સૂર્યમંત્રનો જાપ જપતા આવ્યા, સ્વામી ? ઋષિઓને સ્થાપી, હિર્ણાક્ષિપુ દાનવને સંહારી, સવા કોડીસહ રાજા પ્રહ્લાદ ભકતને ઓધારી. પાંચ કોડીનું ભરણ ભરાવી, તમે ભલે અવતર્યા યુગે યુગે દેવ મુરારી. જે કોઈ ચિત્ત હરિશું લાયે તેના ધર્મ વધે ને પાપનો ક્ષય થાય. નમો નમો ભાઈ પરિબ્રહ્મ નારાયણનાં નામનો, જેણે રૂપે આપણા સદ્ગોર બ્રહ્મા ? નર નારયણ હોય ? આજ તે રૂપને ધાઈએ.

અવતાર ચોથો શ્રીનૃસિંહ, સોળ કોડી (૧૬,૦૦,૦૦,૦૦૦) કુળ પરિવાર ચાર લાખ બત્રીસ હજાર (૪,૩૨,૦૦૦) વર્ષ વર્તિ.

દિશા ઉત્તર, સ્થળ હંસપુર, દાગ વનદાગ, પહેલા કર્તાયુગનું પરણામ સત્તર લાખ અઠયાવીશ હજાર (૧૭,૨૮,૦૦૦) તેમાં મજમહ્લે મોટા અવતાર ચાર (૪).

સંપૂર્ણ

શ્રી નૃસિંહનાં મુનાયક (૩૮)વંશ વઢણ (૩૯) વિર લો ચન (૪૦) કશ્યપ ઋષિ (૪૧) વંશ તો શ્રીવામન ભગવાન (૪૨).

શ્રીવામન ભગવાનની માતા તો લીલાવતી, પિતા તો કશ્યપ ઋષિ, શક્તિ તો દેવી કોકીલા, ગોર તો સહજાનંદ, સ્થાન તો બગપુર, ક્ષેત્ર વનથળી ત્યાં દર દલો દાનવ તો બળીરાજા વિચાર

realpatidar.com

https://archive.org/details/bk1187/page/n27/mode/1up

realpatidar.com

તો યજુર્વેદ ઓચરંતે ગાયત્રી, સાતવાર સત્તાવીશ નક્ષત્ર, પંદર તિથિ બાર કરણ, નવ ગ્રહ, સુર્ય મંત્રનો જાપ જપતા આવ્યા સ્વામી ! ઋષિઓને સ્થાપી, બળી દર્હીતને સંહારી, કમલધ્વજ ભક્તને ઓધારી તમે ભલે અવતર્યા યુગે યુગે દેવ મુરારી જે કોઈ ચિત્ત હરિશું લાયે, તેના ધર્મ વધે ને પાપનો ક્ષય થાય. નમો નમો ભાઈ પરિબ્રહ્મ નારાયણના નામને. જેણે રૂપે આપણા સદગોર બ્રહ્મ, નર નારાયણ હોય ! આજે તે રૂપને ધાઈએ.

અવતાર પાંચમો શ્રી વામન, ચાર લાખ બત્રીસ હજાર (૪,૩૨,૦૦૦) વર્ષ વર્તિ.

સંપૂર્ણ

શ્રીવામનના માનધાતા (૪૩) પૃથ્વિજય, (૪૪) અસરત (૪૫) જમદગ્નિઋષિ, (૪૬) વંશ તો શ્રીપરશુરામ ભગવાન (૪૭).

શ્રી પરશુરામ ભગવાનની માતા તો રેણુકાં, પિતા તો જમદગ્નિ, શક્તિ તો માતા કાલિકા ભવાની, ગોર તો જનક દેવ, સ્થાન તો માયાપુર. ક્ષેત્ર તો કૈલાશ પાટણ. ત્યાં નર દલો દાનવ તો શેહસ્રાર્જુન, વિચાર તો યજુર્વેદ. ઓચરંતે ગાયત્રી સાત વાર, સતાવીશ નક્ષત્ર, પંદર તિથિ બાર કરણ નવ ગ્રહ, સૂર્ય મંત્રનો જાપ જપતા આવ્યા સવામી ! ઋષિયોને સ્થાપી શેહસ્રાર્જુન દાનવને સંહારી, કમલધ્વજ ભક્તને ઓધારી, તમે ભલે અવતર્યા, યુગે યુગે દેવ મુરારી, જે કોઈ ચિત્ત હરિશું લાયે,

realpatidar.com

https://archive.org/details/bk1187/page/n28/mode/1up

realpatidar.com

તેના ધર્મ વધે ને પાપનો ક્ષય થાય. નમો નમો ભાઈ પરિબ્રહ્મ નારાયણના નામનો જેણે રૂપે આપણા સદ્ગોર બ્રહ્માજી. નરનારાયણ હોય ! આજ તે રૂપને ધાઈએ.

અવતાર છઠ્ઠો શ્રી પરશુરામ ચાર લાખ બત્રીસ હજાર વર્ષ (૪,૩૨,૦૦૦) વર્તિ.

સંપૂર્ણ

શ્રી પરશુરામના રઘુ (૪૮) નઘુ, (૪૯) યયાતી, (૫૦) કેવળીક, (૫૧) અજેપાલ, (૫૨) દશરથ, (૫૩) વંશ તો શ્રીરામ ભગવાન (૫૪).

શ્રી રામ ભગવાનની માતા તો કૌશલ્યા, પિતા તો દશરથ શક્તિ તો સીતાદેવી, ગોર તો વશિષ્ઠમુનિ, સ્થાન તો અયોધ્યા, ક્ષેત્ર તો લંકાપુરી, ત્યાં નર દલો દાનવ તો દશાશિશ રાવણ, વિચાર તો યજુર્વેદ, ઓચરંતે ગાયત્રી સાત વાર, સતાવશી નક્ષત્ર, પંદર તિથિને બાર કરણ, નવ ગ્રહ, સુર્ય મંત્રનો જાપ જપતા આવ્યા, સ્વામી ! ઋષિઓને સ્થાપી, દશાશિશ રાવણને સંહારી, સાત કોડીસહ રાજા હરિશ્ચંદ્ર ભક્તને ઓધારી, તમે ભલે અવતર્યા યુગે યુગે દેવ મુરારી. જે કોઈ ચિત્ત હરિશુ લયે. તેના ધર્મ વદે ને પાપનો ક્ષય થાય. નમો નમો ભાઈ પરિબ્રહ્મ નારાયણના નામને જેણે રૂપે આપણા સદ્ગોર બ્રહ્મા, નર નારાયણ હોય, આજે તે રૂપને ધાઈએ.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1187/page/n29/mode/1up

realpatidar.com

અવતાર સાતમો શ્રીરામ છત્રીસ કોડી (૩૬,૦૦,૦૦,૦૦૦) કુળ પરિવાર ચાર લાખ બત્રીસ (૪,૩૨,૦૦૦) વર્ષ વર્તિ.

દિશાપૂર્વ, સ્થળ બગપુર, દાગ જળ દાગ, બીજા ત્રેતાયુગનાં પ્રમાણ બાર લાખ છન્નુ હજાર (૧૨,૯૬,૦૦૦) વર્ષ, તેમાં મજમહ્લે મોટા અવતાર ત્રણ (૩).

સંપૂર્ણ

શ્રીરામના લવ (૫૫) પદ્મ, (૫૬) પરિક્ષિત, (૫૭) વિરપાલ, (૫૮) વાસુદેવ, (૫૯) વંશ તો શ્રીકૃષ્ણ ભગવાન (૬૦).

શ્રી કૃષ્ણ ભગવાનની માતા તો દેવકી, પિતો તો વાસુદેવ, શક્તિ તો દેવી રૂક્ષ્મણિ. ગોર તો વેદવ્યાસ, સ્થાન તો ગોકુલ ક્ષેત્ર તો મથુરા. ત્યાં નર દલો દાનવ તો કંસાસુર વિચારતો સામવેદ, ઓચરંતે ગાયત્રી, સાતવાર સત્તાવીશ નક્ષત્ર, પંદર તિથિ બાર કરણ, નવ ગ્રહ, સૂર્યમંત્રનો જાપ જપતા આવ્યા, સ્વામી ! ઋષિયોને સ્થાપી, કંસાસુર દાનવને સંહારી, સહદેવ (વિદુર) ભક્તને ઓધારી, તમે ભલે અવતર્યા, યુગે યુગે દેવ મુરારી. જે કોઈ ચિત્ત હરિશું લાયે. તેના ધર્મ વધે ને પાપનોક્ષય થાય. નમો નમો ભાઈ પરિબ્રહ્મ નારાયણના નામને જેણે રૂપે આપણા સદ્‌ગોર બ્રહ્મા, નર નારાયણ હોય? આજ તે રૂપને ધાઈએ.

અવતાર આઠમો શ્રી કૃષ્ણ, ચાર લાખ બત્રીસ હજાર

realpatidar.com

https://archive.org/details/bk1187/page/n30/mode/1up

realpatidar.com

(૪,૩૨,૦૦૦) વર્ષ વર્તતે.

સંપૂર્ણ

શ્રી કૃષ્ણના પ્રદુમન (૬૧) અનિરુદ્ધ (શેષસ્થાન), (૬૨) બુદ્ધસ્થાન, (૬૩)વેણી વચ્છરાજ, (૬૪)સિંહરાજ, (૬૫) વંશ તો શ્રી બુદ્ધ ભગવાન (૬૬).

શ્રીબુદ્ધા ભગવાનની માતા તો રેણુકા પિતા તો સિંહરાજ, શકિત તો દેવી હર્ષદ, ગોર તો હંસરાજ, સ્થાન તો હીમવંતી નગરી, ક્ષેત્ર તો કુરૂક્ષેત્ર. ત્યાં નરદલો દાનવ તો દુર્યોધન, વિચાર તો સામવેદ, ઓચરંતે ગાયત્રી, સાત વાર સત્તાવીશ નક્ષત્ર, પંદર તિથિ બાર કરણ નવ ગ્રહ સૂર્ય, મંત્રનો જાપ જપતા આવ્યા,સ્વામી ? ઋષિયોને સ્થાપી, દુર્યોધન દાનવને સંહારી, નવ કોડીસહ રાજા યુધિષ્ઠિરને ઓધારી, તમે ભલે અવતર્યા યુગે યુગે દેવ મુરારી, જે કોઈ ચિત્ત હરિશુ લાયે, તેના ધર્મ વધે ને પાપનો ક્ષય થાય. નમો નમો ભાઈ પરિબ્રહ્મ નારાયણના નામનો. જેણે રૂપે આપણા, સદ્ગોર બ્રહ્મા નર નારયણ હોય ?? આજ તે રૂપને ધ્યાઈએ.

અવતાર નવમો શ્રી બુદ્ધ છપ્પન કરોડી (૫૬,૦૦,૦૦,૦૦૦) કુળ પરિવાર. ચાર લાખ બત્રીસ હજાર (૪,૩૨,૦૦૦) વર્ષે વર્તતિ.

દિશા દક્ષિણ, સ્થાળ સામપુર, (ગોકુલ) દાગ અગ્નિદાગ, ત્રીજા દ્વાપર યુગનું પ્રમાણ. આઠ લાખ, ચોસઠ હજાર (૮,૬૪,૦૦૦) વર્ષ વર્તતે. જેમાં મજમહ્લે મોટા અવતાર બે (૨).

realpatidar.com

realpatidar.com

શ્રી બુદ્ધ ભગવાન પછી તેવીસ પાત્ર ચોવીસમાં શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનનું આખર સ્થળ દ્વિપે સદ્વિપે જાંબુદ્ધિપે. ભરતખંડે-કુવારિકાક્ષેત્રે ગુર્જર દેશે પંચનદી મૂળસ્થાન રેવા ઓત્રે ષોડસ (સોળ) જોજને વૈરાટ વામ મહાસરસ્વતી-સાભ્રમતિ પૂર્વ ત્રષ્ટે નવસ્થળે ગીરમથા ગામે પીરાણા મુકામે શ્રી ઈન્દ્ર ઈમામશાહ મહારાજે આખર સ્થળ સ્થાપંતે ત્યાં નરદલો દાનવ તો દર્હીત કાળીગો.

વિચાર તો અથર્વવેદ આચરંતે ગાયત્રી સાતવાર સતાવશી નક્ષત્ર, પંદર તિથિ, બાર કરણ, નવગ્રહ સૂર્યમંત્રનો જાપ જપતા આવ્યા. સ્વામી ? ઋષિઓને સ્થાપી દર્હીત કાળીંગાને સંહારવા, બાર કરોડી ત્રિકમ ભગતને સ્થાપી અનંત કરોડીનાં ભરાણાં ભકત કમળાકુવરને શીર ભરાવવા તમે ભલે અવતરો યુગે-યુગના, દેવ મોરારી. જે કોઇ ચિત્ત હરીશું-લાએ તેના ધર્મ- વધેને પાપનો ક્ષય થાયે. નમો નમો ભાઇ પરિબ્રહ્મ-નારાયણ નામને જેને રૂપે સદ્ગોર બ્રહ્મા નર-નારાયણ હોય તે રૂપને ધાઇએ.

અવતાર દશમો શ્રીનિષ્કલંકી નારાયણ ભગવાન વર્ષ ચાર લાખ ને બત્રીસ હજાર (૪,૩૨,૦૦૦) વર્ષનો વર્તિ.

દિશા પશ્ચિમ, સ્થળ હેમપુર, દાગ ભુમિદાગ, ચોથા કલિયુગનું પ્રમાણ ચાર લાખને બત્રીસ હજાર (૪,૩૨,૦૦૦) વર્ષ તેમાં મજમલ્લે મોટો અવતાર એક (૧).

realpatidar.com

https://archive.org/details/bk1187/page/n32/mode/1up

realpatidar.com

ધર્મશાસ્ત્ર સુણંતે પાપ તેનાં હરંતે મોક્ષ-મુગટ ફળ લાભંતે, માને તેને સ્વર્ગાપુરી.

સદ્‌ગુરુ ઈમામશાહ

।।ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમઃ।।

●●●

ઋગ્વેદી ગાયત્રી

ૐ ૐ ૐ કારમ્. અનાદિ પુરુષમ્. નરૂપમ્. નરેખા, નિષ્કંલકઃ, નપાણિઃ, નપાદઃ, અભૂત્ મંગલ વર્તતિ, બ્રહ્મા ૐ બ્રહ્મોન્નાદઃ આધરૂપઃ વેદરેખા માત્રઃ, મહાતેજાઃ, પરિબ્રહ્મ ચતુમૂર્તિઃ, ઈશ્વર, કૃતવાન્ વેદઃ પરિબ્રહ્મઃ, ઋગ્વેદો રકતવર્ણ, વર્ણાદિવિષ્ણુઃ, બ્રહ્મવંશ પાત્રઃ, અતીવ પરિબ્રહ્મઃ, પરમેશ્વરમ્, પરમ પરમઃ, પરિબ્રહ્મઃ, પ્રજવાલયતિ પાતકત્, હુતાશનમય તેજ વંશાદિ પાત્રમ્, વેદઃ પરિબ્રહ્મઃ.

●●●

યજુર્વેદી ગાયત્રી

ૐ ૐ ૐ કારમ્ વેદવાયકે અક્ષર :, બ્રહ્મ વિભૂતિ :, પૂજયભૂતાત્ પરિવર્તતે, પ્રજ્વાલયતિ પાતકમ્, પરમેશ્વરમ્, પરિબ્રહ્મ રૂપરેખઃ વેદો અભૂતુ, જગતી પરમેશ્વર : પરાપરમ પરમઃ, પરિબ્રહ્મઃ વંશાદિઃ પાત્રો અભુત્ જગતી વેદ : પરમેશ્વર : પરિબ્રહ્મ સર્વ : પરિબ્રહ્મ :, શબ્દ : પરમેશ્વરઃ પરિબ્રહ્મઃ, યજુર્વેદો

realpatidar.com

https://archive.org/details/bk1187/page/n33/mode/1up

realpatidar.com

જરદ્દવર્ણ:, વર્ણાદિ વિષ્ણુઃ પરિબ્રહ્મ :

●●●

સામવેદી ગાયત્રી

ૐ ૐ ૐ કારમ્ કૃષ્ણાદિવર્ણમ્ તદા વેદ : પરમેશ્વરઃ, ઉપજાયમાન ધર્મઃ, તદાર્ધ, પાતકં પ્રજ્વાલ્યતે, સર્વવંશાદિ, પાત્રઃ, પૂજાંગમ્ પરિબ્રહ્મઃ, તત્વમ્, મંગલષ્ય મહદગંમ્ વર્તેતે શબ્દશ્ચવેદશ્ચ, પરિબ્રહ્મ, ૐ શબ્દ : પરિબ્રહ્મઃ, ૐ ચક્ષુ : પરિબ્રહ્મ :, ૐ ઉન્નાદ :, મહાવેદો અડ્ગમ્, પરિવર્તતિ વિધાડ્ગમ્, પરમેશ્વર, પરિબ્રહ્મ :,

●●●

અથર્વવેદી ગાયત્રી

ૐ ૐ ૐ કારમ્ કલ્યંગકર્તા, વિંશતિવિસ્વાપાપમ્, વિશ્વાધર્મ :, અરૂધ્ધં પાતકમ્, ધર્મોરિખા માત્રઃ, ધર્મ ઈતિ પરિબ્રહ્મઃ, અથર્વવેદ : શ્વેતવર્ણ :, વર્ણાદિવિષ્ણુઃ સવિષ્ણુ નારાયણ :, બ્રહ્માંગમ્, બ્રહ્મવંશાદિઃ પાત્ર : વર્ણાદિ ધર્મો મ્લેચોઅભૂજગતિ, ઈચ્છાંગોવિષ્ણુનારાયણઃ, અત : પરિવક્ષ્યામિ મહાજ્ઞાનભેદમ્ જમ્બુદ્વીપે કલાંગમ્ પવિત્રં વર્તમાનમ્, મહાકલીયુગ ઉપજાયતે નારાયણઃ તેજે ભવિતા, અંગકર્તા, પ્રજવાલયતિ પાતકમ્, અનાર્દિ : પુરુષ :, મમજીવનંભવતિ આર્યાગમ્, પરિબ્રહ્મ : ષોડશંકંમ્ મંગલશ્ચ

realpatidar.com

email: mail@realpatidar.com

https://archive.org/details/bk1187/page/n34/mode/1up

realpatidar.com

સત્વાનિ, સત્યાત્રાદિપરમેશ્વર :, પરિબ્રહ્મ : અનાદિ પુરુષ વેલાંગમ્ ભવતિ કર્મયતિ પરિબ્રહ્મ : સ્થળે સેવાંગમ્ નમ : સર્વ ઈતિ પરિબ્રહ્મ : પરમેશ્વર :, પરિબ્રહ્મ :.

●●●

મોક્ષ માર્ગની ગાયત્રી

ભરત ખંડે ઈહ : વૃતંતે સ્વામી વાસ્તે ગત : વર્તતે, પરમ સુખામી દ્વીપે સદ્વીપે જંબુદ્વીપે કોટાંગ કોટાંગ. જીવનંગ પરમ મુક્તિમય : મિંધ : ઓત્રંગ દેશંગ કુમારીકા, ક્ષેત્રંગ મુકત ગંગ સત્ય મુખંગ વભૂત નગર વૈરાટ વામે. ભવેતંગ, મહા સર્સતિ સાબ્રમતિ પૂર્વ ત્રષ્ટે નવસ્થળ, ગુમટિ રેવા ઓત્રંગ, ષોડશ જેજનંગ, પંચર્નાદિ મૂળ સ્થાને, દિશા ઓત્રંગ, સત્ય રૂપી બ્રહ્મવાયકે મહાનાાયણ વચને, કલિયુગ અંતે બુદ્ધ શાસ્ત્રંગ, હુરાવરણે, સમાવર્તગ દશાંગ. સુરજામં મહા મંગલમય, ફુલપદ: દેહે. માસે, દિવસે, તિથિ, વારે નક્ષત્રે, હુરાવરણે સ્થાપનાએ, ભ્રમડે એ તે, સ્થળે ઉપજતે નિષ્કળંકી નારાયણ પરિબ્રહ્મ : આદે. ઊપજંતે પરમ પ્રેમ હોતવંગ ક્ષેત્ર મહા કળિયુગે કૃતવંગ, નારાયણ નવી સૃષ્ટિ સ્થાપંતે, તદા હોતવંગ સમાત્યંગ. છેલ્લી સંધે નિષ્કલંકી નારાયણ પરિબ્રહ્મઃ ને નમો નમ : ।।

●●●

realpatidar.com

https://archive.org/details/bk1187/page/n35/mode/1up

realpatidar.com

અર્ચના!

હે પરંબ્રહ્મ !! હે અદ્વિતિય પરમ તત્વરૂપ, શાંત, નિરંજન પૂર્ણના પૂર્ણ, હે સચ્ચિસ્વરૂપ પરંબ્રહ્મ પરમાત્માન ! હું તને પ્રણામ કરું છું !!

હે પ્રભુ ! તું વંદનીય છો આખું વિશ્વ તારી આગળ નમ્ર છે. તું સમગ્ર દશ્ય અને અદશ્ય સૃષ્ટિના પદાર્થો અને પ્રાણી કરતાં પણ શ્રેષ્ટ છે, હું તને નમસ્કાર કરું છું !

હે પ્રભુ ! તું જ જગતનો આશ્રયદાતા અને પાલનકર્તા છે: ઉત્પત્તિ અને લય કર્તા પણ તું જ છે, તુ પરાત્પર નિશ્ચલ અને નિર્વિકલ્પ છે. પ્રાણી માત્રના ગતિરૂપ અને પાવનનો પાવન તું છે. ઉચ્ચમાં ઉચ્ચ નિયંતા પણ તું જ છે હે જીવન સાક્ષી હું તારું જ સ્મરણ કરું છું, ધ્યાન ધરું છું, ઉપાસના કરું છું અને નમસ્કાર કરું છું !!!

હું તારો દાસોનોદાસ છું. તારો આશ્રિત છું સર્વત્ર તું જ છે. તેથી તું મારી દુવાસનાનો નાસ કરી મને તારા ચરણકમળમાં આશ્રય આપ !!!

હે જગન્નિયંતા ! આ શરણાગતનું રક્ષણ કર. હે ઈશ્વર મને ઈન્દ્રય સુખ કે કીર્તિ નથી જોઈતા ચમત્કાર બતાવનારી સિધ્ધિ નથી જોઈતી. હે દીનદયાળ ! હું માત્ર શુધ્ધ ભક્તિ અને નિર્મણ પ્રેમ માગું છું !!!

realpatidar.com

https://archive.org/details/bk1187/page/n36/mode/1up

realpatidar.com

હે જગતકર્તા, વિશ્વમોહિની માતા ! માયાના કારણે તને ભૂલી ન જાઉં એવી તું મારા પર કૃપા કર. તારી પ્રાપ્તિ થાય તેવું જ્ઞાન અને ભક્તિ આપી કૃપા કર.

હે દીન વત્સલ, દયા સિંધું ! હું આપનું રૂપ ઓળખવા અસમર્થ છું. આપનામાં અને મારામાં મોટો ભેદ હોવા છતાં હું આપનો જ છું મારા પર દયા કરો

ૐ નમો શ્રી નિષ્કલંકી નારાયણાયજનાર્દ નમ !

શ્રી નિષ્કલંકી નારાયણાય નમો નમ :

●●●

આપણો ધર્મ

- ❖ જેનાથી જીવનમાં દુર્ગુણોનો વિનાશ થાય અને સદ્દ્ગુણોનો વિકાસ થાય એનું નામ ધર્મ
- ❖ જે બીજાના સુખે સુખી થવાની અને બીજાના દુઃખે દુઃખી થવાની સદ્દ્ભાવના જગાડે એનું નામ ધર્મ. (જન સેવા એજ પ્રભુ સેવા)
- ❖ જેના દ્વારા જડ પ્રત્યે વિરકિત અને જીવો પ્રત્યે પ્રીતિજન્મે એનું નામ ધર્મ.
- ❖ જે નશ્વર સાથેનો સંબંધ તોડી આપે અને ઈશ્વર સાથેનો સંબંધ જોડી આપે એનું નામ ધર્મ.
- ❖ ધર્મ એ તો જીવનમાં પળેપળ જીવવાની વસ્તુ છે. જીવનમાં

realpatidar.com

https://archive.org/details/bk1187/page/n37/mode/1up

realpatidar.com

પ્રત્યેક પળે આપણો કંઈક ધર્મ છે. કંઈક કર્તવ્ય છે. એવું સમજીને જાગૃતિપૂર્વક જીવવું એનું નામ ધર્મ.

●●●

સંત વંદના

સંત વિશ્વકલ્યાણના આધાર સ્થંભ છે. તેઓની પ્રત્યેક ગતિવિધિ પ્રાણીમાત્રના કલ્યાણ માટે હોય છે. તેમની વાણીમાંથી જ્ઞાનામૃત ઝરે છે. તેમના ચક્ષુમાંથી સદાય પ્રેમની શિતળ અમી વહેતી રહે છે. તેમના હૃદયમાં આનંદનો પ્રવાહ અવિરત ઝરે છે. અને તેથી જે કોઈ તેમના સંપર્કમાં આવે છે, તે પુણ્યશાળી બની જાય છે.

સંતનું નિવાસ સ્થાન તીર્થભૂમિ બની જાય છે. તેમનો ઉપદેશ પાવન સત્કર્મ બની જાય છે. જે પ્રત્યક્ષ યા પરોક્ષરૂપે જગતના કલ્યાણ કાર્યો કરતાં જ રહે છે.

દુ:ખિયાને આશ્વાસન આપનાર, સન્માનર્ગથી ચલિત થનારને પૂણ્યને પંથે વાળનાર, સમાજમાં પ્રવેશેલી વ્યસનોની જીવલેણ બદીઓને દૂર કરી, માનવજીવનમાં સુસંસ્કારોની અમૃતધારા વહેવડાવનારા એ નર-નારાયણને લાખ લાખ વંદના!

શ્રી સતપંથ સનાતન ધર્મની જય !

તારી પળ પળ જાય સવા લાખની
માળા ભજીલે નકળંકનાથની

realpatidar.com

https://archive.org/details/bk1187/page/n38/mode/1up

realpatidar.com

મા-બાપને ભૂલશો નહિ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ,
અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહિ.
પથ્થર પૂજયા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું,
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છૂંદશો નહિ.
કાઢી મુખેથી કોળિયા, મોંમાં દઈ મોટા કર્યા,
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ.
લાખો લડાવ્યા લાડ તમને, કોડ સહુ પુરા કાર્યા,
એ કોડના પૂરનારના, કોડ પૂરવા ભૂલશો નહિ.
લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા,
એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલસો નહિ.
સંતાનથી સેવા ચાહો, તો સંતાન છો સેવા કરો,
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ.
ભીને સૂઈ પોતે અને, સૂકે સુવાડયા આપને,
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ.
પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર,
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ.
ધન ખરચતાં મળશે બધું માતા પિતા મળશે નહિ,
પળપળ પાવન એ ચરણની ચાહના ભૂલશો નહિ.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1187/page/n39/mode/1up

realpatidar.com

સભા વિસર્જન વખતે રક્ષણનો મંત્ર

સ્વામી ! તમે વાટે ઘાટે મુશ્કેલ આસન કરો ।। વિઘ્ન દુર કરો ।। શયતાન તોફાન દુર કરો ।। વાડી તમારી હરીભરી રાખો ।। ખટ્ટી કમાઈમાં લાભ આપો ।। જગત-વ્યવહારમાં લજ્જા આબરૂ રાખો ।। તમારે નીમ-ધર્મે ।। તમારી દશાંશ સુકૃત્ય ।। તમારી ક્રિયા આચારે ।। તમારી ગત ગંગા ઉપર મહેરબાની રાખો ।। જાંબુ દ્વિપના ધણી ।। તમે ઉપન્યા ઉંચ સ્થાન ।। સહસ્ત્રદ્વિપ આર્યવર્તે કીધાં મુકામ ।। તમે વસ્યા ઉંચ મૂળ સ્થાન ।। જેણે ગુર્જર ખંડમાં કીધાં ઠામ ।। તેનું પાત્ર બ્રહ્મા ઈન્દ્ર ઈમામશાહ નામ ।। જે કરશે અનંત કરોડ જીવોનાં કામ ।। તે આદ્ય વિષ્ણુ નિરંજન નારાયણ ।। તમે સેવકની મુશ્કેલ આસાન કરો ।। લક્ષ ચોર્યાસીના ફેરા ટાળો ।। તેત્રીસ કરોડીના મેળા આપો ।।

સદ્‌ગુરૂ ઈમામશાહ મહારાજ

ૐ શ્રી નિષ્કલંકી નારાયણને નમો નમ :

realpatidar.com

https://archive.org/details/bk1187/page/n40/mode/1up

realpatidar.com

દેવાયત પંડિતની આગમવાણી (ભજન)

દેવાયત પંડિત દાડા દાખવે, સુણી લે દેવળ દેનાર,
આપણા ગુરૂએ આગમ ભાખ્યાં, જૂઠડાં નહિ રે લગાર :
લખ્યારે ભાંખ્યારે સોઈ દિન આવશે : ટેક...
પહેલાં પહેલાં પવન ફરૂકશે, નદિએ નહિ હોય નીર,
ઉત્તર દિશાએથી સાહેબો આવશે, મુખ્ય હનુમંત વીર : દેવાયત...
ધરતી માથે રે હેમર હાલશે, સૂના નગર મોજાર,
લક્ષ્મી લૂંટાશે લોકો તણી, નહિ એની ધાં ફરિયાદ : દેવાયત...
પોરો આવ્યો રે સંતો પાપનો, ધરતી માંગે છે ભોગ,
કેટલાક ખડગે સંહારશે, કેટલાક મરશે રોગ : દેવાયત...
ખોટા પુસ્તક ખોટા પાનિયા, ખોટા કાજીના કુરાન,
અસલ જાદી ચૂડો પેરશે, એવા આગમના એંધાણ... દેવાયત...
કાંકરીએ તળાવે તંબુ તાણસે, સો સો ગામની સીમ,
રૂડી રે વેળા રળિયામણી, ભેળા અર્જુનને ભીમ : દેવાયત...
જતિ સતીને સાબરમતી, ત્યાં હોસે શૂરાના સંગ્રામ,
કાયમ કાલીંગાને મારશે, નકલંક ધરશે નામ : દેવાયત...
પશ્ચિમ દિશાથી સાહેબો આવશે, આવે મારા જુગનો જીવન, હાર
કળિયુગ ઉથાપી સતયુગ થાપસે, બોલ્યા
દેવાયત પંડિત : દેવાયત...

realpatidar.com

realpatidar.com

જય

ઓમ શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન નીજય

શ્રી સદ્દગુરુ ઇમામશાહ મહારાજની જય

શ્રી ઉમીયાં માત કી જય

શ્રી વીર ચંદન સેવક ની જય

શ્રી શાણા કાકા મહારાજની જય

શ્રીનાયાજી પાવુ મહારાજની જય

શ્રી ભાભા રામ મહારાજની જય

શ્રી કીકીબાઇ મહારાજની જય

શ્રી કરશનદાસજી મહારાજની જય

શ્રી જગદ્દગુરૂ નાનકદાસજી મહારાજની જય

કોટી કોટી વંદન હરી ૐ

ૐ શાન્તી શાન્તી શાન્તી

હરી ૐ

realpatidar.com